

ક્રિ.પ.અ.નં.૨૮૩/૨૦૨૬

ભારતીય નાગરીક સંહિતાની કલમ-૪૯૭ અને ૫૦૩ મુજબની અરજી હેઠળ

ટુંકમ...

- ૧.. અરજદારની હાલની અરજી વંચાણે લીધી.અરજદાર તથા વિ.એ.પી.પી.શ્રીને સાંભળ્યા, રજૂ દસ્તાવેજો ધ્યાને લીધા. તપાસ કરનાર અમલદારનો અભિપ્રાય તેમજ રજૂ દસ્તાવેજો ધ્યાને લીધા.
- ૨.. અરજદારની અરજીની ટુંકમાં હકીકત એવી છે કે, તેઓ ઉપરોક્ત સરનામે હાલમાં રહે છે અને તેઓની સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ જે બનાવમાં તેઓના Bank OF BARODA A/C NO.39340100003907 તથા State Bank of India A/C NO.40931903802 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.96,940 /- (અંકે રૂપિયા છન્નુ હજાર નવ સો ચાલીસ પુરા) ઉપડી ગયેલ હતા જે બાબતે અરજદારે NCCRP PORTAL હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર કોલ કરીને ફરીયાદ નંદાવેલ હતી. જેનો ફરીયાદ ટીકીટ નં.૩૧૧ ૦૨૨૬૦૦૪૩૧૯૯ છે.ત્યારબાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સામેવાળા (૧) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /- (૨) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /-(૩) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /- (૪) State Bank of India A/C

NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-(પ) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,990 /-(ઢ) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /-(જ) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,250 /-(ઁ) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.20,000 /-(લ) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૦) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૧) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.751 /-(૧૨) ICICI Bank A/C NO.007401529486 IFSC CODE -ICIC0000074 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.800 / (૧૩) Indian Bank A/C NO.8248135212 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.5,749 /- (૧૪) Bank of Baroda A/C NO.40408100006590 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,400 /- (૧૫) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-એમ મળી કુલ રકમ રૂપિયા 70,790/- (અં કે રૂપિયા સિત્તેર હજાર સાતસો નેવું પુરા) ખોટી રીતે જતાં રહેલ હતા

જે બી.એન.એસ.એસ.-૨૦૨૩ ની કલમ ૪૯૭ તથા ૫૦૩ મુજબ ફીઝ કરેલ છે. જે હાલ સુધી બેંકમાં જેમના તેમ પડી રહેલ છે અને તેઓને પરત મળેલ નથી. આ બાબતે કોઈ જ એફ.આઈ.આર. થયેલ નથી. જેના કારણે તેઓને ખૂબ જ મોટું આર્થિક નુકશાન થયેલ છે અને તેઓને ગુજરાન ચલાવવા માટે સદરહુ રકમની ખૂબ જ જરૂર હોઈ સદર નાણાં તેઓના ખાતામાં પરત અપાવવા માટે ભારતીય નાગરીક સંહિતાની કલમ-૫૦૩ અન્વયે યોગ્ય હુકમ કરવા અરજ કરેલ છે.

૩.. અરજદારની અરજી સબબ તપાસ કરનાર અમલદાર પોલીસ અધિક્ષક, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઇમ, ગાંધીનગરનાઓને સદર મુદ્દામાલ બાબતે તમામ પેપર સહિત સ્પષ્ટ અભિપ્રાય રજૂ કરવા હુકમ કરેલ છે.

૪.. ત્યારબાદ નાયબ પોલીસ અધિક્ષકશ્રી, સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ, સી.આઈ.ડી.ક્રાઇમ, ગાંધીનગરનાઓએ તા.૧૮-૧૧-૨૦૨૪ ના રોજ તેમનો અભિપ્રાય રજૂ કરેલ છે. જે અભિપ્રાય તથા લગત કાગળો ધ્યાને લેતાં તેઓએ જણાવેલ છે કે હાલના અરજદાર શ્રી કંચન નારાયણસિંહ પવાર નાઓ સાથે સાયબર ક્રાઇમનો બનાવ બનેલ હતો જેમાં અરજદારના બેંક ખાતામાંથી રૂ.96,940 /- (અંકે રૂપિયા છન્નુ હજાર નવ સો ચાલીસ પુરા) ઉપડી ગયેલા હતા, જે બાબતે તેઓએ ફરિયાદ નોંધાવેલી હતી, જે ફરિયાદના આધારે સાયબર ક્રાઇમ સેલ- સીઆઈડી ક્રાઇમ દ્વારા અરજદારના ઉપરોક્ત ખાતામાંથી ગયેલ નાણાં પૈકી સામાવાળા (૧) Jio Payment Bank Ltd A/C

NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /- (૨) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE - JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /-(૩) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /- (૪) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-(૫) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,990 /-(૬) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /-(૭) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,250 /-(૮) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.20,000 /-(૯) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૦) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૧) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.751 /-(૧૨) ICICI Bank A/C NO.007401529486 IFSC CODE -ICIC0000074 માં

અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.800 / (૧૩) Indian Bank A/C NO.8248135212 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.5,749 /- (૧૪) Bank of Baroda A/C NO.40408100006590 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,400 /- (૧૫) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-એમ મળી કુલ રકમ રૂપિયા 70,790/- (અં કે રૂપિયા સિત્તેર હજાર સાતસો નેવું પુરા) ડિ.પ્રો. કોડની કલમ : ૧૦૫ મુજબ ફીઝ કરાવેલ છે. જે નાણાં પાછા ખેંચવા માટે અરજદારે આપ નામ.કોર્ટમાં અરજી કરેલ હોઈ અને તે સારુ તેમનો અભિપ્રાય માંગવામાં આવેલ છે. જે બાબતે તેઓએ જણાવેલ છે કે અરજદારના સામાવાળા શં કાર્પદ (૧) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /- (૨) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /-(૩) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,920 /- (૪) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-(૫) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,990 /-(૬) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,000 /-(૭) Bank of India A/C

NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.1,250 /-(૮) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.20,000 /-(૯) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૦) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.11,510 /-(૧૧) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.751 /-(૧૨) ICICI Bank A/C NO.007401529486 IFSC CODE -ICIC0000074 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.800 / (૧૩) Indian Bank A/C NO.8248135212 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.5,749 /-(૧૪) Bank of Baroda A/C NO.40408100006590 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,400 /- (૧૫) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના ગયેલ નાણાં પૈકી રૂ.2,495 /-એમ મળી કુલ રકમ રૂપિયા 70,790/- (અં કે રૂપિયા સિત્તેર હજાર સાતસો નેવું પુરા) ફીઝ થયેલ છે જે સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાયેલ છે તથા સદર ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર અથવા તો અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેઓ(પોલીસ) સમક્ષ કોઈ વાંધા તકરાર લીધેલ નથી જેથી તે રૂપિયા અરજદારને પાછા આપવા તેમના અભિપ્રાયમાં જણાવેલ છે.

પ.. સદરકામે અરજી સાથે રજૂ કરવામાં આવેલ બેંક પેપર્સની નકલ ધ્યાને લ

તેતાં તેમજ તપાસ કરનાર અમલદાર ધ્વારા રજૂ કરવામાં આવેલ અભિપ્રાય તથા તેને લગત કાગળો ધ્યાને લેતાં એ હકીકત સ્પષ્ટ થાય છે કે અરજદારના અરજીમાં જણાવેલ બેંક ખાતામાંથી નાણાં ઉપડી ગયેલ હોવાનું અને શંકાસ્પદ બેંકના ખાતામાં ટ્રાન્સફર થયેલ હોવાનું હાલના તબક્કે સ્પષ્ટપણે જણાઈ આવે છે. તેમજ રેકર્ડની હકીકત જોતાં આ કામે આજદિન સુધી કોઈ એફ.આઈ.આર. થયેલ હોય કે કોઈને ધરપકડ કરવામાં આવી હોય તેમ જણાઈ આવતું નથી. તેમજ બનાવ બન્યે ઘણો લાંબો સમય પસાર થયેલ હોવા છતાં આજદિન સુધી અરજદાર સિવાય અન્ય કોઈએ આ નાણાંની અત્રેની અદાલત સમક્ષ માગણી કરતી કોઈ અરજી દાખલ કરેલ નથી. તેમજ ત.ક.અમલદારનો અભિપ્રાય ધ્યાને લેતાં તેમના સમક્ષ પણ કોઈએ આ નાણાંની માગણી કરેલ હોય તેમજ જણાતું નથી. વધુમાં ત.ક.અમલદાર ધ્વારા સદર બેંક ખાતા બનાવટી હોવાનું જણાવેલ છે અને આ ખાતું સીઝ કર્યા બાદ ખાતેદાર કે અન્ય કોઈ વ્યક્તિએ ખાતું સીઝ કર્યા બાબતે તેમની સમક્ષ કોઈ પાંધા તકરાર લીધેલ નથી અને આ તમામ હકીકત અને સંજોગોના આધારે ત.ક.અમલદારે સદર નાણાં અરજદારને આપવા સ્પષ્ટ અભિપ્રાય આપેલ છે. તેવા સંજોગોમાં અરજદાર સદર નાણાંનો કબજો મેળવવા હકકદાર છે તેમ અત્રેની અદાલતનું સ્પષ્ટપણે માનવું છે.

૬.. આ તબક્કે નાણાં પરત આપવા બાબતે અત્રેની અદાલતની સત્તા હકુમત જોતાં ભારતીય નાગરીક સંહિતાની કલમ-૫૦૩ માં નીચે મુજબ જોગવાઈ કરવામાં આવેલ છે. :-

- (1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry or trial, the Magistrate may make such order as he thinks

fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property.

- (2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation.

આમ, ફોજદારી કાર્યરિતી અધિનિયમની કલમ : ૪૫૭(૧)માં જણાવ્યા મુજબ જ્યારે કોઈપણ પોલીસ અધિકારી દ્વારા મિલકતની જ પ્તીની જાણ મેજીસ્ટ્રેટને કરવામાં આવે અને તપાસ દરમિયાન આવી મિલકત અદાલત સમક્ષ રજૂ કરવામાં આવેલ ન હોય ત્યારે મેજીસ્ટ્રેટને આવી મિલકતના નિકાલ અથવા તો કબજા બાબતે યોગ્ય લાગે તેવો હુકમ કરવાની સત્તા આપવામાં આવેલ છે. તદઉપરાંત નામ.ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગોવિંદભાઈ તેજાભાઈ બારીયા વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૧ (૨) જી.એલ.એચ.૭૨૬ના કેસમાં પેરા નં .(૯.૨), ૧૦ તથા (૨૨)માં પણ નીચે મુજબ ઠરાવેલ છે.

- (9.2)Shri Pandya has cited so many authorities with regard to legal possession of Sec. 451 and Sec. 452 of [Cr.P.C.](#) Here in this case owner lodged a complaint in the police station for which offence has been registered for theft having been committed in respect of two vehicles. That two vehicles have been found from the possession of the purchaser but at the same time the Investigating Officer has come to a conclusion that complainant

has filed a false case and therefore muddamal vehicles are seized during the course of the police investigation and Investigating Officer has reported about such seizure of two vehicles, from the purchaser to the Court and therefore Sec. 457 of [Cr.P.C.](#) will be applicable. In no case Sec. 451 [Cr.P.C.](#) will be applicable to this case. Sec. 457 of [Cr.P.C.](#) reads as follows:

"Sec. 457 Procedure by police upon seizure of property:

- (1) Whenever the seizure of property by any police officer is reported to a Magistrate under the provisions of this Code, and such property is not produced before a Criminal Court during an inquiry of trial, the Magistrate may make such order as he thinks fit respecting the disposal of such property or the delivery of such property to the person entitled to the possession thereof, or if such person cannot be ascertained, respecting the custody and production of such property."
- (2) If the person so entitled is known, the Magistrate may order the property to be delivered to him on such conditions (if any) as the Magistrate thinks fit and if such person is unknown, the Magistrate may detain it and shall, in such case, issue a proclamation specifying the articles of which such property consists, and requiring any person who may have a claim thereto, to appear before him and establish his claim within six months from the date of such proclamation."
- (10) On reading aforesaid section, it is crystal clear that words "may make such order as he thinks fit" are of much importance. When word 'may' is used discretion has been given to the learned Magistrate, of course that discretion is to be exercised judicially keeping in mind the well settled principles of law. The words "to the person entitled to the possession thereof" are also important and relevant. **From the papers if the learned Magistrate has come to a conclusion that particular person is entitled to the**

possession of the vehicles then he can pass the order directing the muddamal article to be handed over to that person. From record it appears that the purchaser has paid Rs.3,10,000/- to the owner of the vehicles and society was knowing about the fact that owner has already sold vehicles to purchaser.

- (22) As discussed earlier, when the learned Magistrate has followed the decision of this Court, in Hussain Amibhai Qureshi (Supra), it cannot be said that he has passed an order contrary to well settled legal position with regard to return of muddamal articles under Sec. 457 of [Cr.P.C.](#) pending the inquiry.

૭.. આમ, ઉપરોક્ત કરેલ ચર્ચા મુજબ સદર કેસની તમામ હકીકત, સંજોગો તથા રજૂ દસ્તાવેજો ધ્યાને લેતાં નાણાં બેંકમાં જમા હોય તેથી સદર રોકડ રકમના દર તેમજ સીરીયલ નંબર બાબતનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તેમજ ભવિષ્યમાં પણ મુદ્દામાલની ઓળખ બાબતની કોઈ તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થાય તેમ નથી. વધુમાં નામ.સુપ્રિમકોર્ટ ધ્વારા સુંદરલાલ અંબાલાલ દેસાઈ વિ. ગુજરાત રાજ્ય, ૨૦૦૩(૧), જી.એલ.એચ. પાના નં .૩૦૭ના ચુકાદામાં પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાને લેતાં પણ ઉપરોક્ત જણાવેલ કારણોસર હાલની અરજી મંજૂર કરવા પાત્ર જણાતી હોઈ ન્યાયના વિશાળ હિતમાં નીચે મુજબનો હુકમ કરવામાં આવે છે.

// હુકમ //

અરજદારની અરજી ભારતીય નાગરીક સંહિતાની કલમ-૫૦૩ અન્વયે આથી મંજૂર કરવામાં આવે છે.

અરજદારને સદર ગુન્હાના કામે સીઝ કરવામાં આવેલ રોકડ રકમ રૂ. 2,92,161/- (અંકે રૂપિયા બે લાખ બાણુ હજાર એકસો એકસઠ પુરા) દોઢી રકમના જાત જામીન (બોન્ડ) તથા તેટલી જ રકમના સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપ્યેથી કેસના આખરી નિકાલ સુધી નીચેની

શરતોને આધિન વચગાળાની કસ્ટડી સ્વરુપે પરત સોંપવાનો હુકમ કરવામાં આવે છે.

વધુમાં હુકમ કરવામાં આવે છે કે, અરજદાર હુકમ મુજબના જાતજામીન (બોન્ડ) તથા સધ્ધર જામીન પો.સ્ટે.માં આપ્યેથી પોલીસ અધિકારી દ્વારા તે મતલબની જાણ તથા સદર હુકમની જાણ જે તે બેંકને કરવી. તેમજ સામાવાળા (૧) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 (૨) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 (૩) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 (૪) State Bank of India A/C NO.00000042735835818 (૫) Bank of India A/C NO.886020110000531 (૬) Bank of India A/C NO.886020110000531 (૭) Bank of India A/C NO.886020110000531 (૮) IDBI Bank A/C NO.1375104000207423 (૯) IDBI Bank A/C NO.1375104000207423 (૧૦) IDBI Bank A/C NO.1375104000207423 (૧૧) Bank of India A/C NO.886020110000531 (૧૨) ICICI Bank A/C NO.007401529486 (૧૩) Indian Bank A/C NO.8248135212 (૧૪) Bank of Baroda A/C NO.40408100006590 (૧૫) State Bank of India A/C NO.00000042735835818 ને હુકમ કરવામાં આવે છે કે, તેઓને પોલીસ અધિકારી દ્વારા અરજદારે હુકમ મુજબના જાતજામીન(બોન્ડ) તથા સધ્ધર જામીન પોલીસ સ્ટેશનમાં આપેલ હોવાની તથા સદર હુકમની જાણ મળ્યેથી દિન-૧૦માં તેમની (૧) Jio

Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,000 /- જમા છે. (૨) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,920 /-જમા છે. (૩) Jio Payment Bank Ltd A/C NO.0028217113493978 IFSC CODE -JIOP0000001 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,920 /- જમા છે. (૪) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,495 /-જમા છે. (૫) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.1,990 /- જમા છે. (૬) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,000 /- જમા છે. (૭) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.1,250 /-જમા છે. (૮) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.20,000 /-જમા છે. (૯) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.11,510 /-જમા છે. (૧૦) IDBI Bank A/C NO.1375104000207423 IFSC CODE -IBKI0001375 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.11,510 /-જમા છે. (૧૧) Bank of India A/C NO.886020110000531 IFSC CODE -BKID0008860 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.751 /-

જમા છે. (૧૨) ICICI Bank A/C NO.007401529486 IFSC CODE -ICIC0000074 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.800 /- જમા છે. (૧૩) Indian Bank A/C NO.8248135212 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.5,749 /-જમા છે. (૧૪) Bank of Baroda A/C NO.40408100006590 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,400 /- જમા છે. (૧૫) State Bank of India A/C NO.00000042735835818 માં અરજદારના જે નાણાં પૈકી રૂ.2,495 /-જમા છે. એમ મળી કુલ રકમ રૂપિયા 70,790/- (અંકે રૂપિયા સિત્તેર હજાર સાતસો નેવું પુરા) જમા છે. તે રોકડ રકમ અરજદારના હાલના અરજદારના State Bank of India A/C NO.40931903802 જમા કરાવી તેની જાણ અત્રેની અદાલતને તથા લગત પોલીસ સ્ટેશનને કરવી.

શરતો :-

- (૧) અત્રેની અદાલત જ્યારે ફરમાવે ત્યારે અરજદારે આ નાણાં અદાલત સમક્ષ રજૂ કરવાના રહેશે.

ઉપરોક્ત શરતનો ભંગ થયેથી હાલનો વચગાળાનો હુકમ આપોઆપ રદ ગણાશે તથા મુદ્દામાલ રોકડ રકમ ફરીથી જપ્ત થવાને પાત્ર રહેશે અને બોન્ડ અને જામીનગીરીની રકમ પણ વસુલ કરવાને પાત્ર રહેશે.

હુકમ આજરોજ ખુદી અદાલતમા વાંચી સંભળાવી જાહેર કર્યો.

તા.૨૩/૦૬/૨૬
મુ.મોડાસા

એ.એન.પી..

(સુરભી શર્મા)
અધિક જ્યુડી.મેજી.ફ.ક.
મોડાસા.
કોડનં.જી.જે.૦૧૫૭૧